

- (1) "Provision to parents of giving education opportunity to their children having age 6 to 14 years ." The above section is added in which set of schedule 86 of Indian constitution under fundamental rights?
 (A) Section -11 (B) Section - 2
 (C) Section -86 (D) Section - 4
- (2) Who is the author of life sketch of Mahadevbhai Desai "Agnikund Mein Uga Hua Gulab"?
 (A) Manbhatt (B) Narayan Desai
 (C) Jayshankar Desai (D) Mahadev Desai
- (3) Who is the author of stanza "Harino Marag Che Shoorano"?
 (A) Kavi Preetam Das (B) Manishankar Ratnajee Bhatta
 (C) Damodar Khushal Botadkar (D) Narsinh Mehta
- (4) Function of Union of India is mentioned in which part of Indian Constitution?
 (A) 6 (B) 4
 (C) 5 (D) 2
- (5) Which Indian sportsperson won bronze in 51 kg category in World Boxing Championship?
 (A) Sukhdev (B) Nishant Dave
 (C) Husamuddin (D) Deepak Bhuriya
- (6) To encourage Indian people for independence movement which English newspaper has been started by Gandhiji in India first?
 (A) Young India (B) Youth India
 (C) Vartaman Bharat (D) Aandolan
- (7) In which age Himalayan Mountain Range formed?
 (A) Satyug (age) (B) Archean age
 (C) Jurassic age (D) Tertiary age
- (8) Stars of sky shine because of which effect of Science?
 (A) Diffusion of Light (B) Refraction of light
 (C) Diffraction of light (D) Division of light
- (9) What is the share of industries in gross national production in India?
 (A) 25% (B) 29%
 (C) 32% (D) 39%
- (10) In which part of Indian constitution, fundamental duties have been included?
 (A) Part -3 (A) (B) Part -5 (A)
 (C) Part - 4 (A) (D) Part - 6 (A)

- (11) Who was the first person to receive "Bharat Ratna" ?
(A) Dr. Rajendra Prasad (B) Dr. Sarvepalli Radhakrishnan
(C) Mahadevbhai Desai (D) Lalbahadur Shastri
- (12) In which of the following programmes interactive board is used?
(A) Pragya Abhigam (B) Bal Project
(C) Virtual Classroom (D) Gyankunj Project
- (13) Unique ID of how many digits is given to the students of a secondary school?
(A) 14 (B) 16
(C) 18 (D) 19
- (14) Education is a subject of which list in Indian Constitution ?
(A) Central List (B) State list
(C) Joint List (D) District list
- (15) In which organ, there is insulin production?
(A) Stomach (B) Pancreas
(C) Large intestine (D) Brain
- (16) In which country Hockey World Cup (Mens) - 2023 was organised?
(A) India (B) Japan
(C) France (D) Brazil
- (17) Where is the World's Biggest Mineral Oil Purification Plant?
(A) Jamnagar (B) Ankleshwar
(C) Digboi (D) Dehradun
- (18) How many leaves including holidays have been decided for Gujarat Secondary and Higher Secondary Schools for the year 2023-24 by Gujarat Secondary and Higher Secondary Education Board?
(A) 79 (B) 80
(C) 81 (D) 82
- (19) According to National Education Policy-2020, which institution has been authorized for monitoring of minimum commercial and quality standards followed by State/Central Schools?
(A) PARAKH (B) SWAYAM
(C) DIKSHA (D) SSSA
- (20) Up to which class education is expected in mother tongue in National Education Policy 2020?
(A) Class 6 (B) Class 8
(C) Class 10 (D) Class 5

- (21) If the syllabus is changed because of business and industries then this is considered as effect of which factors on educational objectives?
 (A) Cultural factors (B) Social factors
 (C) Economical factors (D) Ethical factors
- (22) "Without thinking on what a person is doing what he should do"? This thought is connected with which goals of education ?
 (A) Ethical goals (B) Goals of attaining knowledge
 (C) Goal of complete life (D) Goals of good use of free time
- (23) Objectives, syllabus, institutions and time limit if all of these are decided then this is considered as which form of education?
 (A) Informal (B) Formal
 (C) Illegal (D) Joint
- (24) Which program does not directly apply to Informal learning?
 (A) Knowledge of alphabets (B) Examination
 (C) Education of business (D) Deaddiction
- (25) Which of the following issues is not included in three issues of learning process?
 (A) Starting (B) Result
 (C) Process (D) Evaluation
- (26) Some children are introverts, some are extroverts, some are talkative and some of them are shy. This type of difference in children is known as -
 (A) Physical difference (B) Difference in personality
 (C) Difference in hobbies (D) Social difference
- (27) Which of the following is not included in different intelligence quotients ?
 (A) Intelligence Quotient (I.Q.) (B) Spiritual Quotient (S.Q.)
 (C) Regional Quotient (R.Q.) (D) Emotional Quotient (E.Q.)
- (28) Who has developed vocational interest modification?
 (A) McDougall (B) Strong
 (C) Morgan (D) Garrett
- (29) Which experiment is used to measure abilities/powers like Art, Music, Creativity in a person?
 (A) Attitude Criteria (B) Interest experiment
 (C) Zest/Rasa modification (D) Aptitude experiment
- (30) Which is not included in three types of internal processes in a class?
 (A) Teacher-Student Behaviour (B) Student-Material Behaviour
 (C) Teacher-Material Behaviour (D) Student-Student Behaviour

- (31) Which of the following is not included in commonly used three middle position statistical measures?
 (A) Mean (B) Median
 (C) Mode (D) Midpoint
- (32) Which is different from the three tests of evaluation ?
 (A) Written (B) Oral
 (C) Practical (D) Functional
- (33) With which of the following is spreadsheet related?
 (A) Microsoft Excel (B) Microsoft Powerpoint
 (C) Microsoft Word (D) Access
- (34) Whose philosophy of education is shown in "Framing and Clading" ?
 (A) Gijubhai Badheka (B) Nanabhai Bhatt
 (C) Taraben Modak (D) J. Krishnamurti
- (35) Education by productive labour, for productive labour, and can only be of productive labour"
 (A) Mahatma Gandhiji (B) Ravindranath Tagore
 (C) Mr. Arvind (D) Swami Vivekananda
- (36) Which of the following principles is not included in principles of John Dewey?
 (A) Principle of utility (B) Principle of inclination
 (C) Principle of labour (D) Principle of zest(rasa)
- (37) New India Literacy Program (NILP) has been started for illiterates of which age group?
 (A) 15 years and above (B) 15 years to 55 years
 (C) 6 years to 14 years (D) 21 years to 65 years
- (38) Which is known as one nation one digital platform ?
 (A) PM eVIDYA (B) BISAG-N
 (C) DIKSHA (D) Vande Gujarat Channel
- (39) Who talked about learning by senses ?
 (A) Dr. S. Radhakrishnan (B) Ravindranath Tagore
 (C) Mahatma Gandhi (D) Maharishi Arvind
- (40) Who started learning by senses for special children?
 (A) Maria Montessory (B) Grace Fernold
 (C) Jim Piaget (D) Ivan Pavlov

- (41) Which of the following pairs of psychologists associated with study is correct?
 (A) Trial and Error - Vygotsky (B) Behaviourism - Pavlov
 (C) Constructivism - Skinner (D) Conditioning by factors – Thorndike
- (42) Which of the following is not a characteristic learning process?
 (A) Experience is necessary for learning
 (B) Interaction with environment is necessary for learning
 (C) Learning can enter from one condition to the other
 (D) Memory is necessary for learning
- (43) Who gave Discovery learning approach ?
 (A) Robert Gagne (B) Jerome Brunner
 (C) Bandura (D) Ausubel
- (44) What will be the area of a circle having radius 14 cm? A formula is used by children to answer this question. Which intellectual skill he or she has obtained?
 (A) Differentiation (B) Concept
 (C) Rule (D) Solution of the problem
- (45) In which of the following disorders intellectual skill of children destroys?
 (A) Down Syndrome (B) ADHD
 (C) Cerebral Palsy (D) Autism
- (46) Which of the following will be on top level according to Bloom's Taxonomy?
 (A) Evaluation (B) Creation
 (C) Isolation (D) Utilization
- (47) Which of the following is unsuitable in achievement test ?
 (A) Sufficient time given to the students to answer all of the questions
 (B) Class is related with progress(development)
 (C) Education work is given at the end
 (D) Questions are selected to test the skills of a student
- (48) Which of the following measurements of middle position cannot be shown?
 (A) Mean (B) Extension
 (C) Median (D) Mode
- (49) Which of the following is not true for standard deviation (σ)?
 (A) Group Category will be as much as the low value of standard deviation
 (B) Standard deviation increases by the addition of any constant number in marks
 (C) If all the marks are multiplied by only one number then standard deviation increases at the same rate
 (D) Standard deviation is used to know the variability of the marks

- (50) Which of the following is not a characteristic of E-content?
 (A) These are only in digital format
 (B) It is presented by webpage or any other medium
 (C) It contains only animation
 (D) It can be linked with QR code.
- (51) Which of the following is not OER ?
 (A) BISAG - N
 (B) GROWER
 (C) NROER
 (D) e-pathshala
- (52) Which of the following subjects (issue) does not apply in the concept of E-learning?
 (A) Learning-Teaching is a present time field.
 (B) Learning has only one option.
 (C) Class learning is interesting
 (D) Information is available online.
- (53) Summary of which cannot be applied excepting its related groups. This is what type of modification?
 (A) Experimental modification
 (B) Survey
 (C) Basic Modification
 (D) Functional modification
- (54) "Children is creator of knowledge and not consumer." This is the conclusion of –
 (A) Behaviourism
 (B) Naturalism
 (C) Rationalism
 (D) Constructivism
- (55) Learning is a natural process and not manmade. Who gave this concept?
 (A) Aristotle
 (B) Rousseau
 (C) Froebel
 (D) Montessori
- (56) R, U, X, A, D, ? To complete the series what will replace the "?" question mark
 (A) F
 (B) G
 (C) H
 (D) I
- (57) 1, 3, 3, 6, 7, 9, 9, 12, 21, ? To complete the series what will replace the "?" question mark
 (A) 10
 (B) 11
 (C) 12
 (D) 13
- (58) 10, 100, 200, 310, ? To complete the series what will replace the "?" question mark
 (A) 400
 (B) 410
 (C) 420
 (D) 430
- (59) In a certain code TEACHER is written as VGCEJGT then in the same code CHILDREN can be written as?
 (A) EJKNEGTP
 (B) EGKNFITP
 (C) EJKNFGTO
 (D) EJKNFTGP
- (60) In a certain code TWENTY is written as 863985 and ELEVEN is written as 323039 then in the same code TWELVE can be shown by which number?
 (A) 863203
 (B) 863584
 (C) 863903
 (D) 863063


- (61) In a certain code language '123' means 'bright little boy' and 145 means 'tall big boy'. In the same way '637' means 'beautiful little flower' then which number will be there for 'bright'?
- (A) 1 (B) 2
(C) 3 (D) 4

- (62) If + means \times , \times means $-$, $-$ means $+$ and $-$ means \div then which of the following numbers will be the solution of $175 - 25 \div 5 + 20 \times 3 + 10$
- (A) 77 (B) 160
(C) 240 (D) 2370

- (63) Select the appropriate option for '?' in the following figure

20160	4
?	4
480	8
96	24

- (A) 860 (B) 1140
(C) 2880 (D) 3240
- (64) How many triangles are there in the given figure?



- (A) 15 (B) 16 (C) 17 (D) 18
- (65) What will be the angle in degrees between minute and hour hand of a clock at 3:40?
- (A) 140 (B) 150 (C) 130 (D) 120

- (66) Select the odd pair:

- (A) Yoghurt-milk (B) Sandal - leather
(C) Peanut - oil (D) Sugar - sugarcane

- (67) Arrange the letters of the given word alphabetically.

- (1) INTERANAL (2) INSECT (3) INCOME (4) INTERN (5) INSIDE
- (A) 3, 2, 5, 4, 1 (B) 3, 4, 5, 2, 1
(C) 4, 5, 1, 3, 2 (D) 3, 1, 2, 4, 5



- (68) If first day of a leap year is Sunday then how many Sundays will be there in the same year?

- (A) 50 (B) 51 (C) 52 (D) 53

- (69) A person drives his car 50 km towards east after that he turns right and drives 30 km. Then he turns west and drives 10 km. How much away he is from the starting point?

- (A) 20 km (B) 50 km (C) 100 km (D) 60 km

(70) Select the different figure.



(A) A

(B) B

(C) C

(D) D

(71) અગ્નિનો સમાનાર્થી છે.

(A) અનલ

(B) અનિલ

(C) અનંગ

(D) તપસ

(72) નીચેનામાંથી કર્મધારેય સમાસનું ઉદાહરણ છે.

(A) તક્ષાધુ

(B) કલ્પવૃક્ષ

(C) પંચામૃત

(D) પરમેશ્વર

(73) તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. - વાક્યનો પ્રકાર ઓળખો.

(A) કર્તરિ

(B) કર્મણિ

(C) ભાવે

(D) પ્રેરક

(74) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચપ્પાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી. આ કાવ્યનો પ્રકાર જણાવો.

(A) દુહા

(B) મુક્તક

(C) હાઈકુ

(D) સોનેટ

(75) ખોટી શ્રેણી કઈ છે ?

(A) સુદૃઢ

(B) દીકરી

(C) અક્સ્માત્

(D) કનિષ્ઠ

(76) 'નીરવ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય ?

(A) સૂમસામ

(B) ધવલ

(C) પીડા

(D) કોલાહલ

(77) સમાનાર્થી શબ્દોની ખોટી શ્રેણી હોય તે વિકલ્પ કયો છે ?

(A) ખોભણ - ગુફા

(B) અનરવો - હિંમતવાન

(C) અડવડિયું - લથડિયું

(D) આર્દતા - મૂઢતા

(78) 'ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂંકે ઊંનનું આસન' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો છે?

(A) દળી

(B) ટેકણિયું

(C) પીઠિકા

(D) માંચડો

(79) વિરામચિહ્નોનો ઉચિત પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું છે ?

(A) હાથ ! હવે નિરાંત થઈ !

(B) પ્રશ્નપત્ર શ્રેઈ વિદ્યાર્થીઓ મૂંઝાયા, એમને કાંઈ સૂઝ પડી નહીં, ઉત્તરપત્રો મૂકી દઈને ચલતી પકડી.

(C) મેં જાણ્યું : મારાં લખાણો એને ગમતાં નથી.

(D)તો મારો દુશ્મન છે.

(80) શબ્દ અને તેના અનેકાર્થી શબ્દોની ખોટી શ્રેણી હોય તેવો વિકલ્પ કયો છે ?

(A) ગુણ - પણ, દોરડું

(B) કૂટ - ઠગાઈ, શિખર

(C) કાંત - મન, અંતઃકરણ

(D) કર - કિરણ, સુંઢ

(81) આપેલ વાક્યોમાં રેખાંકિત કરેલ શબ્દનો ઉચિત પ્રયોગ થયો હોય તેવું વાક્ય કયું છે ?

(A) મેં આ પત્ર કે ઠરાવ વાંચ્યા નથી.

(B) કામ વેળાસર થાય તે જ અગત્યનું છે.

(C) સાંજે છ વાગે જાહેર ગ્રંથાલય બંધ થાય છે.

(D) દરેકે આવકમાંથી યથાશક્તિ પ્રમાણે દાન કરવું શ્રેઈએ.

- (82) 'દેવ્યૈશ્વર્ય' શબ્દનો સંધિવિગ્રહ શું થાય ?
 (A) દેવ + ઐશ્વર્ય (B) દેવે + એશ્વર્ય
 (C) દેવ્ય + ઐશ્વર્ય (D) દેવી + ઐશ્વર્ય
- (83) આપેલાં વાક્યોમાં 'કર્મણિ વાક્ય' કયું છે ?
 (A) એ સમયમાં લોકો જુગાર રમતા. (B) એણે પચાસ માણસોને જમાડ્યા.
 (C) સરકાર તરફથી આ મહિને અનાજ અપાયું છે. (D) અશોક કંઈ બોલ્યો ન હોત.
- (84) 'છત્રી પર નામ-સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો.' - વાક્યમાં રેખાંકિત કરેલ શબ્દ 'ખરેખર' ક્રિયાવિશેષણનો કયો પ્રકાર છે ?
 (A) અભિગમવાચી ક્રિયાવિશેષણ (B) સમયવાચક ક્રિયાવિશેષણ
 (C) રીતિવાચક ક્રિયાવિશેષણ (D) સ્થાનવાચક ક્રિયાવિશેષણ
- (85) 'મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું.' - અલંકાર ઓળખાવો.
 (A) વ્યક્તિરેક અલંકાર (B) અતિશયોક્તિ અલંકાર
 (C) રૂપક અલંકાર (D) ઉપમા અલંકાર
- (86) Mahesh was too smart. (Remove 'too' without changing the meaning.)
 (A) Mahesh was not smart at all.
 (B) Mahesh was smart more than required.
 (C) Mahesh was foolish.
 (D) I was doubtful whether Mahesh was smart or not.
- (87) INS Arihant is Indian Naval ship. (Fill in the blanks)
 (A) The & an (B) An & an
 (C) A & an (D) The & the
- (88) Most students have brought their homework. of them have not completed it yet.
 (A) None (B) Few
 (C) Each (D) A little
- (89) મેં મારા વાળ કપાવ્યા. - આ વાક્યનું ચોક્કસ અંગ્રેજી ભાષાંતર શું થશે ?
 (A) I cut my hair. (B) I clipped my hair.
 (C) I got my hair cut. (D) I had a nice hair cut.
- (90) Give the nearest meaning of word : 'Phantom'.
 (A) existent (B) imaginary
 (C) corporeal (D) tangible
- (91) Give the verb form of 'little'.
 (A) alittle (B) unlittle
 (C) belittle (D) bilittle

- (92) Change the voice : "What caused COVID-19?"
 (A) What was COVID-19 caused by ? (B) What was caused by COVID-19 ?
 (C) By what is COVID-19 caused ? (D) By what COVID-19 was caused ?
- (93) Select the word or phrase which is closest to the opposite in meaning of the underlined word : "Rahul will never accept your request."
 (A) turn over (B) turn down
 (C) turn up (D) reject
- (94) Add a suitable question tag : Radha, one of my neighbours slipped off a staircase. ?
 (A) did she (B) does she
 (C) doesn't she (D) didn't she
- (95) Fill in the blanks with appropriate set of prepositions : Nidhi travelled her mother all the world when she was 17 years old.
 (A) by, above (B) for, around
 (C) with, around (D) with, over
- (96) Turn this sentence into English : "હજુ પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો."
 (A) I could still saw her standing there alone. (B) I could still see her stood there alone.
 (C) I could still see her standing there alone. (D) I can still see her standing there alone.
- (97) Fill in the blanks with the appropriate word / words : Rohan and Nayan have been on vacation May 2023. They to Manali for a week.
 (A) for, had gone (B) since, had gone
 (C) for, have gone (D) since, have gone
- (98) Mantra got the first prize last week. Find out the correct option to get the underlined answer.
 (A) Which prize did Mantra get last week ?
 (B) When did Mantra get the first prize ?
 (C) Which prize Mantra got last week ?
 (D) Where did Mantra get the first prize ?
- (99) Ravi in this company for five years. Find out correct form of verb from the options.
 (A) works (B) is working
 (C) has been working (D) have worked
- (100) Find out the correct spelling from the options.
 (A) Spactacular (B) Spectacular
 (C) Spactaculor (D) Specteculor

(101) અહીં એક કાવ્યનો ભાવાર્થ રજૂ કર્યો છે તે વાંચી તે કૃતિનું નામ જણાવો.

ભાવાર્થ : જનની, જન્મભૂમિ સ્વર્ગદિપિ ગરિયસિ, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે - એને ક્યારેય ભૂલાય એમ નથી.

(A) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી

(B) ગુર્જરીના ગૃહકુંજે

(C) હું એવો ગુજરાતી

(D) દિવસો જુદાઈના જાય છે.

(102) સાહિત્યકાર અને કૃતિના જોડકાં ધ્યાને લો.

સાહિત્યકાર	કૃતિ
1. ઝવેરચંદ મેઘાણી	- બોળો
2. સુરેશ જોષી	- જન્મોત્સવ
3. મણિલાલ હ. પટેલ	- પખીલોક
4. યુનીલાલ મડિયા	- શરણાઈના સૂર

ઉપરના પૈકી કયા જોડકાં સાચાં છે ?

(A) માત્ર 1, 2 અને 3 (B) માત્ર 1, 2 અને 4 (C) માત્ર 1, 3 અને 4 (D) 1, 2, 3 અને 4

(103) નીચેના પૈકી કયા શબ્દની રચના 'પૂર્વપ્રત્યય' અને 'પરપ્રત્યય' બંને લગાવવાથી થઈ છે.

(A) બિનજરૂરી

(B) દયાળુ

(C) પથિક

(D) અજ્ઞાની

(104) મારી અડવી ભીંતોને એના આંગળાં ઓચ્છવ મારે આંગણે કાવ્યપંક્તિ પૂર્ણ કરો.

(A) લાવ્યાં સો-સો કલમની સુગંધ

(B) એને ટોડલિયે ટહુકાર

(C) હૈયે હૂંફને જીવતરની હાસ

(D) જ્યાં જ્યાં પરશે ત્યાં સોહે શણગાર

(105) નીચે આપેલા વાક્યમાં વપરાયેલા સંયોજકનો પ્રકાર જણાવો. - રમેશે કહ્યું કે 'મારે બીજી એક મીટિંગ છે.'

(A) દષ્ટાંતવાચક

(B) વિરોધાવાચક

(C) સમુચ્ચયવાચક

(D) અવતરણવાચક

(106) 'ધોરણ - 9 અને 10 ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકના મુખ્ય પૃષ્ઠ પર કયા 'ભારતીય જ્ઞાનપીઠ' મેળવનાર સર્જકની છબી છે ?

(A) પન્નાલાલ પટેલ

(B) ઉમાશંકર જોષી

(C) રાજેન્દ્ર શાહ

(D) રઘુવીર ચૌધરી

(107) 'એક બપોરે' કવિતામાં કવિ રાવજી પટેલની કઈ વેદના વ્યક્ત થઈ છે ?

(A) ચલમની તમાકુમાં હવે કસ નથી.

(B) બપોરનો તડકો અસહ્ય છે.

(C) મૃત્યુને નજીકથી જોવે છે.

(D) ખેતરને શેઢેથી સારસી ઊડી ગઈ છે.

(108) આપેલ વાક્યોમાં રેખાંકિત શબ્દમાંથી કયો શબ્દ રવાનુકારી નથી ?

(A) કીર્તિ તીખી તમતમ પાણીપુરી ખાય છે.

(B) બંદૂકમાંથી સનનન કરતીક ગોળી છૂટી.

(C) એ રાત્રે સુસવાટા કરતો પવન ફૂંકાતો હતો.

(D) મહેશે રાત્રે બુમાબુમ કરી.

(109) નીચે આપેલા વાક્યોને તેના ઘટનાક્રમ મુજબ ગોઠવો.

1. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે.

2. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો.

3. માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને પીંધ્યા છે.

4. માત્ર એના કપાયેલા પગના માંસની મિજબાની માણવા ઉંદરો આવ્યા.

(A) 2, 4, 3, 1

(B) 4, 2, 3, 1

(C) 2, 3, 4, 1

(D) 4, 2, 1, 3

- (110) નીચેના વાક્યો 'જન્મોત્સવ' કૃતિમાંથી લેવામાં આવ્યા છે તે વાક્ય કોણ બોલે છે તે અંગે કઈ જોડ સાચી છે ?
1. 'હાવ પાંગળાં ના કરતા દાદા; અક્કરમીએ મધરાતે સાંઈ જનમ લીધો, નકર...' - દેવજી
 2. 'ગાંડી થા મા માણકી, તારા નંદકુવરને કોઈ ચોરી નથી ગયું, લે આ તારો છોરો.' - દેવજી
- (A) માત્ર - 1 (B) માત્ર - 2
(C) 1 અને 2 બંને (D) 1 અને 2 માંથી એક પણ નહીં
- (111) "મારો બાળપણનો જિગરજન દોસ્ત છે. બાબુ ઈની બઉ યાદ આવે છે.... ઈને તેડાવો..." આ વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ?
- (A) દેવલો - ગંધર્વને કહે છે. (B) દેવલો - ઈન્દ્ર રાજાને કહે છે.
(C) ઈન્દ્ર રાજા - દેવલાને કહે છે. (D) ઈન્દ્રરાજા - દેવદૂતને કહે છે.
- (112) નીચેનામાંથી કયું વિશેષણ વિકારી નથી ?
- (A) ઉત્સાહી (B) મીઠું (C) શાણું (D) ઊંચું
- (113) નીચેના જોડકાં ધ્યાને લો.

કૃતિ	સંદર્ભ
1. મારા સપનામાં આવ્યા હરિ	- છ અકારનું નામ
2. જન્મોત્સવ	- ગૃહપ્રવેશ
3. એ લોકો	- પ્રબલગતિ
4. ઝબકજ્યોત	- વડલો

ઉપરના પૈકી કયા જોડકાં સાચાં છે ?

- (A) માત્ર 1, 2 અને 3 (B) માત્ર 1, 2 અને 4 (C) માત્ર 1, 3 અને 4 (D) 1, 2, 3 અને 4

- (114) સંધિ વિગ્રહ માટે સાચો વિકલ્પ પસંદ કરો : સિંધુ + ઊર્મિ
- (A) સિંધૂર્મિ (B) સિંધૂર્મા (C) સિંધુર્મિ (D) સિંધુર્મા
- (115) એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદુ પડે તો દાક્તરને સજા કરતા - આપેલ વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા જણાવો.
- (A) ગામ (B) દાક્તર (C) ચીન (D) લોકો
- (116) સુંદર નવપલ્લવિત વૃક્ષ ઊગી જવાની એ તીવ્ર પ્રતીક્ષા કરી રહી હતી. - આ વાક્યને આધારે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ વિશેષણ નથી ?
- (A) સુંદર (B) નવપલ્લવિત (C) તીવ્ર (D) પ્રતીક્ષા
- (117) કૃતિ અને પાત્રનાં જોડકાં ધ્યાને લો.

કૃતિ	પાત્ર
1. લોહીની સગાઈ	- અમરતકાકી, ગંગુ
2. નથી	- કાન્તિ, કંચનમાસી
3. સો ટયનું સોનું	- કુતમ્મા, ઐયપ્પા
4. શરણાઈના સૂર	- રમઝુમીર, સકીના

ઉપરના પૈકી કયા જોડકાં સાચાં છે ?

- (A) 1, 2, 3 અને 4 (B) માત્ર 1, 2 અને 3 (C) માત્ર 1, 2 અને 4 (D) માત્ર 2, 3 અને 4

(118) પરપ્રત્યય લાગી બનેલો શબ્દ શોધો.

- (A) વણથંભી (B) ઋણી (C) નિષ્કળ (D) કમજેર

(119) 'ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભળે રે રે?' આપેલ પંક્તિમાં રેખાંકિત શબ્દ સર્વનામનો કયો પ્રકાર સૂચવે છે ?

- (A) સ્થળવાચક સર્વનામ (B) સ્વવાચક સર્વનામ
(C) જથ્થાવાચક સર્વનામ (D) સમયવાચક સર્વનામ

(120) જો ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો પૂર્ણાવસ્થા દર્શાવવા કયો પ્રત્યય વપરાય છે ?

- (A) ત (B) ય (C) ડ્ (D) વ

(121) સાચાં જોડકાં જોડો.

I

II

1. તેજમલ a. ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતું લોકગીત
2. ચાંદલિયો b. પ્રભુ તરફનો પ્રેમ અને સત્કારનો આનંદ
3. હરિ ! આવોને c. કુટુંબજીવનના સંબંધોનું મધુર ચિત્ર
4. ક્યારે વાગી d. સ્ત્રીનું વીરત્વ અને મહત્તાનું લોકગીત

- (A) 1-d, 2-c, 3-a, 4-b (B) 1-d, 2-a, 3-b, 4-c
(C) 1-d, 2-c, 3-b, 4-a (D) 1-d, 2-b, 3-a, 4-c

(122) આપેલ શબ્દના સંધિવિગ્રહમાંથી ખોટો વિકલ્પ ઓળખી બતાવો.

- (A) પવન - પો + અન (B) યથેષ્ટા - યથા + ઈષ્ટ
(C) ગંગોર્મિ - ગંગા + ઊર્મિ (D) પૂલેન્દુ - પૂર્ણ + ઈન્દુ

(123) કોઈ કામ માટે સૂચન, વિનંતી, આગ્રહ આદિ જેવી આડકતરી પ્રેરણા અપાય તો તે વાક્ય ક્યું વાક્ય કહેવાય ?

- (A) આજ્ઞાર્થ (B) વિધ્યર્થ (C) નિર્દેશાર્થ (D) પ્રશ્નાર્થ

(124) 'ભાડાખત' - એ કયો સમાસ છે ?

- (A) તત્પુરુષ સમાસ (B) મધ્યમપદલોપી સમાસ
(C) દ્વિગુ સમાસ (D) ઉપપદ સમાસ

(125) 'હવે હું તમને બધું આપીશ' - વાક્યનો પ્રકાર જણાવો ?

- (A) મિશ્રવાક્ય (B) સાદુવાક્ય (C) સંયુક્તવાક્ય (D) સંકુલવાક્ય

(126) નીચેનામાંથી કયા વિરુદ્ધાર્થી શબ્દોની જોડ સાચી નથી ?

- (A) સાકાર - નિરાકાર (B) સુગમ - દુર્ગમ (C) સચિત - નિશ્ચિત (D) સુબોધ - કુબોધ

(127) 'તમારી વાત હું નથી સમજતી હું મા છું દુશ્મન તો નથી ને' - આ વાક્યમાં યોગ્ય વિરામચિહ્નો ક્યાં આવશે ?

- (A) સમજતી પછી પ્રશ્નાર્થ ચિહ્ન, છું પછી અલ્પવિરામ અને ને પછી પ્રશ્નાર્થ ચિહ્ન
(B) સમજતી પછી પૂર્ણવિરામ, છું પછી અલ્પવિરામ અને ને પછી ઉદ્ગાર ચિહ્ન
(C) સમજતી પછી પૂર્ણવિરામ, છું પછી અલ્પવિરામ અને ને પછી પ્રશ્નાર્થચિહ્ન
(D) સમજતી પછી અર્ધવિરામ, છું પછી અલ્પવિરામ અને ને પછી પ્રશ્નાર્થચિહ્ન

- (128) નીચેનામાંથી કઈ ધ્વનિશ્રેણી સાચી નથી ?
- (A) હાથોહાથ - હ + આ + થ + ઓ + હ + આ + થ
 (B) કાર્યક્રમ - ક્ર + આ + ર + ય્ + અ + ક્ર + ર + અ + મ્
 (C) સર્વોત્તમ - સ્ + અ + ર્ + વ્ + સો + ત્ + અ + મ્
 (D) તૃષ્ણા - ત્ + ઋ + પ્ + ણ્ + આ
- (129) આપેલ સંજ્ઞાના પ્રકારોમાં કયો પ્રકાર અમૂર્ત સંજ્ઞા સૂચવે છે ?
- (A) ભાવવાચક સંજ્ઞા (B) ક્રિયાવાચક સંજ્ઞા (C) દ્રવ્યવાચક સંજ્ઞા (D) જાતિવાચક સંજ્ઞા
- (130) સમાનાર્થી કહેવતો માટે જુદો પડતો વિકલ્પ પસંદ કરો.
- (A) કૂમળું ઝાડ વાળીએ તેમ વળે - પાકે ઘડે કાંઠા ન ચડે.
 (B) તરત દાનને મહાપુણ્ય - ધીરજનાં ફળ મીઠાં
 (C) વસુ વિના નર પશુ - નાણાં વિનાનો નાથિયો નાણે નાથાલાલ
 (D) ઝાઝા હાથ રળિયામણાં - ઝાઝી કીડી સાપને તાણે.
- (131) 'માની મમતાથી ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું જ નથી.' એ ભાવ સાથે કઈ પંક્તિ અસંગત છે ?
- (A) સૂર, તાલ ને સંગીત મળશે, ટહુકો માનો ક્યાં ?
 (B) પલ્લવ ને પુષ્પો તો મળશે, પાલવ માનો ક્યાં ?
 (C) ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની ક્યાં ?
 (D) બારે ઊમટે મેહ, હેતની કેટલી માની ક્યાં ?
- (132) જોડણીભેદથી અર્થભેદ ન થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો.
- (A) કેશ - કેસ (B) હંમેશ - હમેશ (C) કડુ - કડું (D) અલિ - અલી
- (133) "ભૂલી ગયા પછી" એકાંકીમાં લેખકે કયા ફેન્ય વિચારકને યાદ કર્યા છે ?
- (A) સાર્ત્ર (B) રૂસો (C) લેવી સ્ટ્રોસ (D) વોલ્ટેર
- (134) "છત્રી પર નામ - સરનામુ લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો." આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દ ક્રિયાવિશેષણનો કયો પ્રકાર સૂચવે છે ?
- (A) રીતિવાચક (B) સમયવાચક (C) અભિગમવાચી (D) માત્રાસૂચક
- (135) રવીન્દ્રનાથ ટાગોરને કયા કાવ્યસંગ્રહ માટે વિશ્વવિખ્યાત 'નોબેલ પારિતોષિક' પ્રાપ્ત થયું હતું ?
- (A) માનસી (B) ગીતાંજલિ (C) ચિત્રા (D) ચૈતાલી
- (136) 'કન્યાપક્ષે કારુણ્યની પરાકાષ્ટા સમુ વિદાયગીત ઉપાડ્યું હતું' - આ વાક્યની રચના કયા પ્રકારની છે ?
- (A) કર્તરિ (B) કર્મણિ (C) ભાવે (D) પ્રેરક
- (137) "આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે. ખમ્મા બાપ ઢેલ ! તારો ગણ જિંદગી લગી શું ભુલાશે ?" - પ્રસ્તુત વાક્યમાં કઈ બોલીનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયો છે ?
- (A) પટ્ટણી બોલી (B) ચરોતરી બોલી (C) સુરતી બોલી (D) સોરઠી બોલી

(138) 'હાઈકું' કાવ્ય સ્વરૂપ વિશે નીચેના વિધાનો ધ્યાને લો.

1. જાપાનમાંથી આવેલ કાવ્ય પ્રકાર છે.
2. 17 અક્ષરનું બંધારણ હોય છે.
3. ત્રણ પંક્તિમાં રજૂઆત થાય છે.
4. ચિત્રાત્મક કાવ્યકૃતિ છે.

ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

- (A) માત્ર - 1 અને 2 (B) માત્ર 1, 2 અને 3 (C) માત્ર 1, 2 અને 4 (D) 1, 2, 3 અને 4

(139) નીચેનાં ઉદાહરણોમાંથી 'પ્રાસસાંકળી' અલંકારનો સાચો વિકલ્પ કયો છે ?

- (A) વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો.
(B) ગાવલડી જેવી માવલડી ને માવલડી જેવી ગાવલડી
(C) પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની રે.
(D) પીગળે પીગળે પડછાયાના પહાડ.

(140) વિરોધી પરિસ્થિતિનો અર્થ આપતી કહેવતો માટે જુદો પડતો વિકલ્પ પસંદ કરો.

- (A) ચેતતો નર સદા સુખી - બહુ ડાઘા બહુ ખરડાય.
(B) અક્કરમીનો પડિયો કાણો - ભાગ્યશાળીને ભૂત રળે.
(C) ગાજ્યા મેહ વરસે નહીં - ભસતાં કૂતરાં કરડે નહીં.
(D) આપ ભલા તો જગ ભલા - દયા ડાકણને ખાય.

(141) નીચેનામાંથી કયું વાક્ય 'સંકુલ' વાક્ય નથી તે જણાવો.

- (A) અરુણિમાએ આફ્રિકાનું કિલિમાંજરો અને યુરોપનું એબ્લુસ સર કર્યું છે.
(B) તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી.
(C) મહારાજ અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો.
(D) મંગુને દવાખાને મોકલવી એટલે જાણે મૂંગા ઢોરને પાંજરાપોળ મોકલવું.

(142) નીચેનામાંથી કઈ સાહિત્ય કૃતિને 'ભારતીય જ્ઞાનપીઠ' પુરસ્કાર મળેલ નથી ?

- (A) ધ્વનિ (B) માનવીની ભવાઈ (C) મળેલા જીવ (D) અમૃતા

(143) નીચે આપેલા વિકલ્પોમાંથી બધી જ જોડણી ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

- (A) સાંસ્કૃતિક, ટિકિન, રિસેસ, નીતિ (B) સાંસ્કૃતિક, ટીફીન, રિસેસ, નિતિ
(C) સાંસ્કૃતીક, ટીફિન, રિશેષ, નીતિ (D) સાંસ્કૃતીક, ટીફિન, રિસેશ, નિતિ

(144) નીચે આપેલા જોડકાંમાંથી છંદ અને તેના બંધારણ માટે કયા જોડકાં યોગ્ય છે ?

છંદ	બંધારણ
1. શિખરણી	- યમનસભલગા
2. મંદાકાન્તા	- મભનતતગાગા
3. પૃથ્વી	- જસજસનલગા
4. વસંતતિલકા	- તભજજનલગા

- (A) માત્ર 1 (B) માત્ર 1 અને 2 (C) માત્ર 1 અને 3 (D) માત્ર 2 અને 4

- (145) જોડણીભેદથી અર્થભેદ થતો હોય તેવો વિકલ્પ પસંદ કરો.
 (A) ગુણ - ગૂણ (B) ક્રિમત - ક્રીમત (C) રાષ્ટ્રિય - રાષ્ટ્રીય (D) વિનંતી - વિનંતિ
- (146) 'વાઈરલ ઇન્ફેક્શન' પાઠમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ કયા છે ?
 (A) ગાંધીજી (B) રાજારામ મોહનરાય (C) સ્વામી દયાનંદ સરસ્વતી (D) સ્વામી વિવેકાનંદ
- (147) 'કાળુને રાજુની ગાળો ગોળથીય મીઠી લાગતી હતી' - વાક્યમાં કયો અલંકાર વપરાયો છે ?
 (A) સજ્જવારોપણ (B) ઉત્પ્રેક્ષા (C) વ્યતિરેક (D) યમક
- (148) વિનોબા ભાવેએ કયા ગ્રંથનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો ?
 (A) રામાયણ (B) મહાભારત (C) ભગવદ્ગીતા (D) ઉપનિષદ
- (149) મને ઓળખો : 'હું દર્શકના નાટકોમાંનું એક નાટક નથી.'
 (A) પરિત્રાણ (B) બંધન અને મુક્તિ (C) ગૃહારણ્ય (D) અંતિમ અધ્યાય
- (150) નીચે પૈકી કર્મણિ રચના કઈ છે ?
 (A) હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી છે. (B) સરકાર તરફથી મહેસૂલ વધારો લાગુ પડાયો.
 (C) નદી મને તાણી જાય છે. (D) પત્નીથી કશું બોલાયું નહિ.
- (151) વિનોબા ભાવેના નામથી વિખ્યાત સર્જકનું મૂળ નામ શું છે ?
 (A) વિજય નરહરિ ભાવે (B) વિનોદ નરહરિ ભાવે
 (C) વિનાયક નરસિંહ ભાવે (D) વિનાયક નરહરિ ભાવે
- (152) 'મારાથી કણસાય છે' - વાક્યની રચનાનો પ્રકાર કયો છે ?
 (A) કર્તરિ (B) કર્મણિ (C) પ્રેરક (D) ભાવે
- (153) 'હાઈકુ' કાવ્ય પ્રકારનું બંધારણ જણાવો.
 (A) 4 + 4 + 4 + 2 = 14 અક્ષર (B) 5 + 7 + 5 = 17 અક્ષર
 (C) 4 + 5 + 3 = 12 અક્ષર (D) 5 + 3 + 5 = 13 અક્ષર
- (154) 'અજ્ઞણ્યું સ્ટેશન' વાર્તા - સંગ્રહના રચયિતા છે.
 (A) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (B) પન્નાલાલ પટેલ (C) સુરેશ જોષી (D) મોહનલાલ પટેલ
- (155) રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે 'જ્ઞાનપીઠ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
 (A) આંદોલન (B) શાંત કોલાહલ (C) ધ્વનિ (D) વિષાદનો સાદ
- (156) કવિશ્રી કલાપી રચિત 'શિકારીને' કાવ્યકૃતિ કયા છંદમાં રચાયેલી છે.
 (A) મનહર (B) શિખરિણી (C) મંદાકાન્તા (D) અનુષ્ટુપ
- (157) નીચેનામાંથી કઈ જોડ જુદી પડે છે ?
 (A) સંક્ષિપ્ત - વિસ્તૃત (B) ભુજંગ - અહિ (C) તત્સમ્ - તદ્ભવ (D) ઉન્નતિ - અવનતિ
- (158) નીચે આપેલ શબ્દમાં કઈ સાચી જોડણી નથી ?
 (A) સ્ફૂર્તિ (B) ચાતુર્માસ (C) પરિસ્થિતિ (D) ક્ષીતિજ

- (159) નીચેનામાંથી કઈ જોડ જુદી પડે છે ?
 (A) જળ - સવિલ - પાણી (B) હથ - તોખાર - અશ્વ
 (C) લોચન - અક્ષી - ચક્ષુ (D) રવિ - સોમ - ભાનુ
- (160) 'રેસનો ઘોડો' નવલિકામાં ઉત્તીર્ણ થવાની ખુસીમાં નીનાબહેને અંકિતને ભેટમાં શું આપ્યું ?
 (A) પુસ્તકો (B) રમકડાં (C) વીડિયો ગેમ (D) ક્રિકેટનાં સાધનો
- (161) 'નરસિંહ' શબ્દનો સમાસ જણાવો.
 (A) તત્પુરુષ (B) બહુવ્રીહિ (C) કર્મધારય (D) ઉપપદ
- (162) "પાને પાને પોઢી રાત, તળાવ જંખ્યું કહેતાં વાત" - પંક્તિનો છંદ જણાવો.
 (A) દોહરો (B) ચોપાઈ (C) અનુષ્ટુપ (D) મનહર
- (163) 'ગતિભંગ' લઘુકથામાં ધૂળમાં પડેલી પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું ?
 (A) ડુંગરની (B) માતાની (C) મૃત દીકરીની (D) વિદેશી દીકરાની
- (164) "પાંચમે લઘુતા તોળો, ગુરુ છદ્ધો લખ્યો; બીજે ચોથે પદે બોલો સ્લોકમાં લઘુ સાતમો" - સૂત્ર કયા છંદનું છે ?
 (A) ચોપાઈ (B) મનહર (C) અનુષ્ટુપ (D) દોહરો
- (165) નીચે પૈકી વિકલ્પોમાં કયું ઉપપદ સમાસનું ઉદાહરણ નથી ?
 (A) દીવાસળી (B) પંકજ (C) પાણીકળો (D) વરદાત્રી
- (166) 'પંગુમ્ લંઘયતે ગિરિમ્' પાઠમાં અરૂણિમાએ એવરેસ્ટ કઈ રીતે સર કર્યું ?
 (A) લાકડીના ટેકે આગળ વધીને (B) શેરપાના માર્ગદર્શનથી
 (C) મજબૂત મનોબળ, હિંમત અને સખત પરિશ્રમથી (D) કૃત્રિમ પર વગર
- (167) નીચે આપેલ શબ્દમાંથી સાચી જોડણીનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
 (A) મૂર્હર્ત (B) મુહૂર્ત (C) મુર્હત (D) મૂર્હત
- (168) 'છાલ, છોતરાં અને ગોટલા' પાઠમાં લેખકે અમેરિકામાં ખેલાડીઓને ઓલિમ્પિકમાં કઈ રમત રાખવાનું સૂચવે છે ?
 (A) ટામેટાં ફેંકવાની (B) પથ્થર ફેંકવાની (C) જૂતાં ફેંકવાની (D) કેળાંની છાલ ફેંકવાની
- (169) નીચેનામાંથી કઈ જોડ સંગત છે ?
 (A) સુધા - રવિ - વ્યોમ (B) હેમ - તરુ - શીતળ
 (C) ઉદધિ - રત્નાકર - જલધિ (D) અરિ - ભાઈબંધ - વીરો
- (170) નીચેના વિધાનો પૈકી કયા વિધાનમાં અભિગમવાચી ક્રિયાવિશેષણનો ઉલ્લેખ થયેલો નથી ?
 (A) અમારી આટલી માગણી ખચીત સ્વીકારશો.
 (B) ભીખલાને હીરો (શીરો) બો (બહુ) ભવે.
 (C) એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે.
 (D) છત્રી ઉપર નામ - સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો.

(171) સૂચિ - I સાથે સૂચિ - II જોડો.

સૂચિ - I

1. સુન્દરમ્
2. લાભશંકર ઠાકર
3. મકરંદ દવે
4. પૂજાલાલ

- (A) 1 - ii, 2 - i, 3 - iv, 4 - iii
(C) 1 - iv, 2 - iii, 3 - ii, 4 - i

સૂચિ - II

- (i) સાવિત્રી પ્રશસ્તિ
- (ii) સંગતિ
- (iii) લથરો
- (iv) કાવ્યમંગલા

- (B) 1 - iv, 2 - ii, 3 - i, 4 - iii
(D) 1 - iii, 2 - iv, 3 - i, 4 - ii

(172) સૂચિ - I સાથે સૂચિ - II જોડો.

સૂચિ - I

1. રાજેન્દ્ર શાહ
2. અશોક ચાવડા
3. વિનોદ જોષી
4. હરીન્દ્ર દવે

- (A) 1 - iii, 2 - i, 3 - iv, 4 - ii
(C) 1 - iv, 2 - i, 3 - ii, 4 - iii

સૂચિ - II

- (i) તૃણિલ તૃણિકા
- (ii) મૌન
- (iii) ડાળખીથી સાવ છૂટા
- (iv) મધ્યમા

- (B) 1 - iv, 2 - iii, 3 - i, 4 - ii
(D) 1 - ii, 2 - iv, 3 - i, 4 - iii

(173) નીચે આપેલી વિરોધી કહેવતની યોગ્ય જોડ બનાવો.

1. મોટા એટલા ખોટાં
2. બોલે એનાં બોર વેચાય
3. ચેતતો નર સદા સુખી
4. જાત મહેનત ઝીંદાબાદ

- (A) 1 - ii, 2 - iv, 3 - i, 4 - iii
(C) 1 - ii, 2 - iii, 3 - iv, 4 - i

- (i) વધુડાઘો વધુ ખરડાય.
- (ii) પારકી આશા સદા નિરાશા
- (iii) ઘરડાં ગાડાં વાળે
- (iv) ન બોલ્યામાં નવ ગુણ

- (B) 1 - iii, 2 - i, 3 - ii, 4 - iv
(D) 1 - iii, 2 - iv, 3 - i, 4 - ii

(174) સૂચિ - I સાથે સૂચિ - II જોડો.

સૂચિ - I

1. ચંદ્રકાન્ત પંડ્યા
2. ગુણવંત શાહ
3. ગાંધીજી
4. જવાહરલાલ નહેરુ

- (A) 1 - iv, 2 - iii, 3 - i, 4 - ii
(C) 1 - iii, 2 - i, 3 - ii, 4 - iv

સૂચિ - II

- (i) સત્યના પ્રયોગો
- (ii) બાનો ભીખુ
- (iii) મારી જીવનકથા
- (iv) જાત ભણીની જાત્રા

- (B) 1 - ii, 2 - i, 3 - iv, 4 - iii
(D) 1 - ii, 2 - iv, 3 - i, 4 - iii

(175) સૂચિ - I સાથે સૂચિ - II જોડો.

સૂચિ - I

1. સુરેશ જોષી
2. રઘુવીર ચૌધરી
3. વર્ષા અડાલજી
4. રાવજી પટેલ

સૂચિ - II

- (i) આકસ્મિક સ્પર્શ
- (ii) વૃત્તિ અને વાર્તા
- (iii) ગૃહપ્રવેશ
- (iv) સાંજને ઉંબરે

(A) 1 - iv, 2 - iii, 3 - ii, 4 - i

(B) 1 - ii, 2 - iii, 3 - iv, 4 - i

(C) 1 - iii, 2 - i, 3 - iv, 4 - ii

(D) 1 - iii, 2 - iv, 3 - ii, 4 - i

(176) વર્ગશિક્ષણ કરતી વખતે અનુસરવામાં આવતાં સોપાનો ક્રમમાં ગોઠવો.

1. વિષયવસ્તુનું વિશ્લેષણ
2. આદર્શ વાંચન
3. મૂલ્યાંકન
4. સ્વાધ્યાય
5. વિષય પ્રવેશ - પ્રસ્તાવના

(A) 2, 3, 5, 1, 4

(B) 5, 2, 1, 3, 4

(C) 3, 4, 2, 5, 1

(D) 5, 2, 3, 4, 1

(177) નીચે આપેલા સૂક્ષ્મ અધ્યાપનનાં સોપાનોને યોગ્યક્રમમાં ગોઠવો.

1. પુનઃ શિક્ષણનો તબક્કો
2. પુનઃ આયોજનનો તબક્કો
3. શિક્ષણનો તબક્કો
4. પુનઃ પ્રતિપોષણનો તબક્કો
5. પ્રતિપોષણનો તબક્કો

(A) 3, 5, 2, 1, 4

(B) 3, 2, 5, 4, 1

(C) 2, 4, 3, 1, 5

(D) 5, 4, 2, 1, 3

(178) ભાષામાં કેટલાક એવા ઘટકો પણ હોય છે કે જે સંજ્ઞા, વિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર, આગ્રહ, વિનંતી, સીમામર્યાદા વગેરે જેવા અર્થોનો ઉમેરો કરે છે. ભાષાના આવા ઘટકોને શું કહેવામાં આવે છે ?

(A) સંયોજક

(B) જકંચર

(C) નિપાત

(D) કૃદંત

(179) નીચે પૈકીના કયા કૌશલ્યો ભાષામાં અભિવ્યક્તિલક્ષી છે ?

(A) કથન - લેખન

(B) વાચન - લેખન

(C) શ્રવણ - વાચન

(D) કથન - વાચન

(180) અમૂર્ત પરથી મૂર્તને અને સામાન્યથી વિશિષ્ટને સમજવાની પ્રક્રિયા થાય છે. ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થયો એમ કહેવાય.

(A) અનુબંધ

(B) આગમન

(C) આગમન - નિગમન

(D) નિગમન

- (181) ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા જરૂરી છે.
 (A) કાવ્ય કંઠસ્થ હોવું (B) કાવ્યનું પઠન કરવું (C) કાવ્યનો અર્થબોધ (D) હાવભાવ
- (182) 'વિશ્વ માતૃભાષા દિન' ક્યારે ઉજવવામાં આવે છે ?
 (A) 21 ફેબ્રુઆરી (B) 21 જાન્યુઆરી (C) 21 માર્ચ (D) 21 એપ્રિલ
- (183) "વ્યાખ્યાનો જ પાઠ્યપુસ્તકો બનવાં જોઈએ, પાઠ્યપુસ્તકોનાં વ્યાખ્યાનો નહિ" - આ વિધાન કોનું છે ?
 (A) આનંદશંકર ધ્રુવ (B) ગાંધીજી (C) કાકાસાહેબ કાલેલકર (D) ઉમાશંકર જોષી
- (184) નીચેનામાંથી કઈ પદ્ધતિ ગદ્ય શિક્ષણની પદ્ધતિ નથી ?
 (A) કથન પદ્ધતિ (B) પ્રશ્ન પદ્ધતિ (C) અર્થબોધ (D) નાટ્યીકરણ પદ્ધતિ
- (185) શિક્ષણ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને માન્ય ઉચ્ચારણ, આરોહ-અવરોહ, યોગ્ય ઝડપ સાથે અર્થવાહી તેમજ ભાવવાહી વાંચન કરે છે તે વાંચનનો કયો પ્રકાર છે ?
 (A) મુખવાંચન (B) મૂકવાંચન (C) આદર્શવાંચન (D) સમૂહવાંચન
- (186) ભાષાના મુખ્ય ચાર કૌશલ્યનો યોગ્ય ક્રમ જણાવો.
 (A) શ્રવણ, વાંચન, લેખન, કથન (B) શ્રવણ, કથન, લેખન, વાંચન
 (C) શ્રવણ, વાંચન, કથન, લેખન (D) શ્રવણ, કથન, વાંચન, લેખન
- (187) કઈ પદ્ધતિ પ્રકૃતિ કાવ્યો, ભક્તિ કાવ્યો, નીતિ કાવ્યોના શિક્ષણ માટે ઉપયોગી છે ?
 (A) અર્થબોધ પદ્ધતિ (B) તુલના પદ્ધતિ (C) ગીત - અભિનય પદ્ધતિ (D) નાટ્યીકરણ પદ્ધતિ
- (188) બેન્જામીન બ્લૂમએ જ્ઞાનાત્મક ક્ષેત્રના હેતુઓને કેટલા વિભાગમાં વહેંચ્યા છે ?
 (A) ત્રણ (B) ચાર (C) પાંચ (D) છ
- (189) વિકાસાત્મક આવર્તન છે.
 (A) પાઠ્યક્રમનો વિકાસ (B) અભ્યાસક્રમનો વિકાસ (C) હેતુઓનો વિકાસ (D) પ્રવૃત્તિઓનો વિકાસ
- (190) પદ્યશિક્ષણ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ ઉત્તમ છે ?
 (A) ગીત - અભિનય પદ્ધતિ (B) વ્યાખ્યાન પદ્ધતિ
 (C) સ્વાધ્યાય પદ્ધતિ (D) રસાસ્વાદ પદ્ધતિ
- (191) પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે ?
 (A) સ્થૂળ (B) માહિતીપ્રદ (C) દ્વિમાર્ગી (D) એકમાર્ગી
- (192) શિક્ષક વર્ગમાં 'ગતિભંગ' પાઠની ચર્ચા કરે છે તો વિદ્યાર્થીઓનું કયું કૌશલ્ય વિકસિત થશે ?
 (A) લેખન (B) શ્રવણ (C) કથન (D) વાંચન
- (193) નીચે પૈકી કયો નિબંધસંગ્રહ બહુલ ત્રિપાઠીનો હાસ્ય નિબંધસંગ્રહ છે ?
 (A) વૈકુંઠ નથી જાવું (B) અષાઢની સાંજ (C) ગોવિંદે માંડી ગોઠડી (D) મન સાથે મૈત્રી
- (194) લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તે સંજ્ઞા કહેવાય.
 (A) ભાવવાચક (B) દ્રવ્યવાચક (C) અવિકારી (D) વિકારી

(195) સૂચિ - I સાથે સૂચિ - II જોડો.

સૂચિ - I	સૂચિ - II
1. બેફામ	(i) પગરવ તળાવમાં
2. બેદિલ	(ii) મહેક
3. ધાયલ	(iii) પ્યાસ
4. ગની દહીંવાલા	(iv) અગ્નિ

(A) 1 - ii, 2 - iii, 3 - iv, 4 - i
(B) 1 - iii, 2 - i, 3 - iv, 4 - ii
(C) 1 - iv, 2 - iii, 3 - ii, 4 - i
(D) 1 - iii, 2 - iv, 3 - i, 4 - ii

(196) મુક્તક સાહિત્યના પ્રકારના લક્ષણો કેટલા ?

(A) પાંચ (B) સાત (C) ત્રણ (D) નવ

(197) 'સમુદ્રમાં સળગતો અગ્નિ' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

(A) દાવાગ્નિ (B) વડવાગ્નિ (C) જઠારાગ્નિ (D) જળાગ્નિ

(198) 'વણલોભી' શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે ? યોગ્ય જવાબ પસંદ કરો.

(A) પૂર્વ (B) પર (C) પૂર્વ અને પર (D) એક પણ નહિ

(199) 'શ્રવણ' શબ્દના ધ્વનિઘટકો (સ્વર-વ્યંજન) છૂટા પાડો.

(A) સ + ર્ + અ + વ્ + અ + ણ્ + અ (B) શ્ + ર્ + અ + વ્ + અ + ણ્ + અ
(C) શ્ + વ્ + અ + ણ્ + અ (D) સ્ + અ + ર્ + વ્ + અ + ણ્ + અ

(200) 'વાચન એ તર્કની પ્રક્રિયા છે.' - આ વ્યાખ્યા આપનાર કોણ ?

(A) થોર્નહાઈક (B) રોબિન્સન (C) રુથ સ્ટ્રેગ (D) ગુડમેન

